

Super Visa/ Visitor to Canada Insurance

Best Mortgage Rates
1st and 2nd Mortgages
Life and Critical Illness Insurance
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
Serving at 2 locations
GTA East / GTA West
Investment | Insurance | Mortgages

परदेशां देशी महेंक अटले

स्वदेश

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amit4tahomes@gmail.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
komal4tahomes@gmail.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 01 JULY, 2022 Vol. 19, No. 26 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

महाराष्ट्रना राजकारणामां 15 दिवसना छार्णोलेख द्रामानो अंत, ढाकरे सरकार पडी लांगी

उद्धवनी पिछाय, शिंदे महाराष्ट्रना नवा सुडानी

सुप्रीमे झलो टेस्टनो आदेश कर्या बाद ढाकरे राज्णामुं धरी दीधुं, लाजपना टेकाथी सरकार बनी, डेप्युटी CM पदे इडलावीस

मुंभर्ण

महाराष्ट्रना राजकारणामां छेव्वा 15 दिवसथी यालतां छार्णोलेख द्रामानो गुरुवारे अंत आव्यो छतो. बुधवारे उद्धव ढाकरेना राज्णामा बाद राज्णामां लाजपना नेता देवेन्द्र इडलावीसना नेतृत्व छेव्ण नवी सरकारनी रचना बनशे तेवी आशा छती. परंतु राष्ट्रीय स्तरे भेलायेला राजकारणामां लाजप मोवडी मंडणना आदेश बाद शिवसेनामां भणवानो उंडो छियो करनारा अेकनाथ शिंदेने मुभ्यमंत्री बनाववामां आव्या छता. ज्यारे लाजपना इडलावीसने डेप्युटी सीअेम बनावाया छता.

महाराष्ट्रना बंने छोदेदारोअे गुरुवारे सांजे ज राज्णपालनी छाजरीमां शपथ लीधा छता. शिंदे शिवसेना नेता बाणढाकरे अने आनंददिवेने श्रद्धांजलि आपीने शपथ लेवानी शरुआत करी छती. आ पछेलां महाराष्ट्र लाजपना नेता अने पूर्व मुभ्यमंत्री देवेन्द्र इडलावीसे, अेकनाथ शिंदेनी साथे राज्णपाल साथे मुलाकात करी छती अने त्यारबाद इडलावीसे मीडियाने संबोधता कहुं छतुं के राज्णना नवा मुभ्यमंत्रीपदे अेकनाथशिंदे रक्षे ज्यारे तेओ सत्ता भडार रक्षे. तेमणे स्पष्ट क्यु छतुं के तेओ सरकारमां सामेल नहीं थाय. परंतु थोडा कलाकोमां ज समीकरणे इरी भदलाया छता अने देवेन्द्र इडलावीसने राज्णना नवा डेप्युटी मुभ्यमंत्री बनावी देवाया छता अने शिंदेनी साथे ज तेमनो पण शपथग्रहण कार्यक्रम योजायो छतो. अडेवालो अनुसार लाजपना राष्ट्रीय प्रमुभ जेपी नडडाअे इडलावीसने मनाववानुं काम कर्युं छतुं. जे बाद पार्टी छार्णकमानड तरक्षी निर्देश मणता इडलावीस र्णकारकरी शक्या नछोता. भीख तरक्ष शिवसेनामां भंगालनी स्थिति यथावत रछेतां आवनारा दिवसोमां राजकीय गरमावो रछेवानी प्रभण संभावना छे.

लाजपे मोटुं मन देभाड्युं : अेकनाथ शिंदे



शपथ लीधा बाद शिंदेअे कहुं छतुं के, विकासना अेवन्डा साथे अमे साथे आव्या छीअे. अमे पाछली सरकारमां रछेवा दरमियान कंठ करी शकता नछोता. मोटी पार्टी छोवा छतां लाजपे मने तक आपी छे. देवेन्द्रज्यअे मोटुं हदय देभाड्युं छे. तेना माटे हुं देवेन्द्रज्यअे आभारी छुं. हुं वडप्रधान नरेन्द्र मोदीज्य, गृहप्रधान अमित शाहज्य, लाजप 2 प्रमुभ जेपी नड्डानो पण आभारी छुं, अमे अमारा मत विस्तारोनी इरियाओ अने विकासकार्यो माटे पूर्व सीअेम ढाकरे पासे गया छता अने तेमने सुधारनी जरूरियातनी सलाह आपी हती पण अमने लाग्युं छतुं के अमारा माटे आगामी चूंटणी छतवी मुश्केल छे.

महाराष्ट्रमां 100-100 करोडमां परीधा MLA : हरिश रावत

हरिश रावते जीजेपी छपर मोटो प्रहार कर्यो छे. तेमणे आरुप लगाव्यो छे के जीजेपीअे 100-100 करोड रुपियामां धारासब्योने परीधा छे. जे भारतीय राजनीतिने शरमावे तेवा छे. उत्तरा षंडना भूतपूर्व सीअेम अने NCPना नेता हरिश रावते तेमना निवेदनमां जल्लव्युं छे के लाजप र्णकमेड्डा, CBI, ED जेवी अंधारणीय संस्थाओना जणे विपक्षी नेताओने धमकाववानुं काम करी छे.

नरेन्द्र मोदीअे अेकनाथ शिंदे, इडलावीसने अभिनंदन आष्या

वडाप्रधान नरेन्द्र मोदीअे अेकनाथ शिंदे अने देवेन्द्र इडलावीसने अभिनंदन पाठव्या छता तेमणे दिवट कर्युं छतुं के, देवेन्द्र इडलावीसने महाराष्ट्रना डेप्युटी सीअेम तरीके शपथ लेवा भदल वधामणी. तेओ दरेक लाजप कार्यकर्ता माटे प्रेरणा छे. तेमनो अनुभव अने कुशलता सरकार माटे अेकसंपति रक्षे. मने विश्वास छे के तेओ महाराष्ट्रना विकास पथने वधाटे मजबूत करशे.

मछिपुरमां जमीन धसी पडतां 13 जवानोना मोत, 50थी वधु लापता



मछिपुर

मछिपुरमां वरसादने कारणे नोनी जिल्लानां तुपुल स्टेशन नखक जमीन धसी पडवानी दुर्घटना बनी छती. जेमां आर्मीनां केम्प नखक बनता आर्मीनां 40थी 450 जवानो दटाई गया छोवानी भीति सेवाई रडी छे. राडत अने बयावटुकडी द्वारा 1 उथी वधु मृतदेडोने भडार काढवामां आव्या छे. ज्यारे 1 उ जवानोने बयाववामां आव्या छे. मृत्युआंक वधे तेवीसंभावना छे. छोनारतमां केटलाक नागरिको पण दटाया छोवानी शंका सेवाई रडी छे. उख 30थी 40 जवानो दटाया छोवानी अडेवालो छे. राज्णनां सीअेमबिरेनसिंह द्वारा घटना अंणे राडत अने बयाव कामगीरी करवानां आदेशो आपवामां आव्या छता.

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More info on PAGE 2
वधु भाडिनी पानु 2 पड

ABOWATH.COM

SUPER VISA INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Closing down sale !
Japanese Sarees, UK Sweaters and much more at attractive prices.

Upto 80% off

\$1 each Blouse Piece • 3 for \$100 Gold Print Jacquard Sarees. • 4 for \$100 Gold Print Sarees. • 5 for \$100 UK Sweaters. • 10 for \$100 Printed Georgette Sarees. • 20 for \$100 Japanese Plain Suit Pcs and many more specials...

Biggest Sale Ever! Just in Time for the festive season!
Uma Sarees

6270 Côte des Neiges, Montreal
514-341-1394

Residential
New Condos
Investments
Commercial

दुरामां याद राजशो

Zakir Patel
Broker

Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir82@gmail.com

छेव्वा 44 वर्षथी टोरान्टोनी सर्व प्रथम गुजराती ट्रावेल अेजन्सी. 44 वर्षथी गुजराती प्रश्न अने गुजराती भाषा अमारी सक्षमता माटे यज्ञभागी छे. दिवथी आपनी अमे भूबज आभार मानीअे छीअे. ह्वाई मुसाहरी नी टिकीट माटे अमारा भाव टोरान्टोमां भूबज आकर्षक छे अजमावी जूओ... आपने आनंद यशे.

Ashok Travels 416-977-9896 अशोक ट्रावेलस ४१६ ९७७ ९८९९

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

ઈમિગ્રેશનના અરજદારોને ટૂંક સમયમાં વધુ સેવા મળવી સંભવ

કોરોનાકાળ બાદ સ્થિતિ સામાન્ય બનવા માંડતા ઈમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફારો શરૂ

ટોરોન્ટો

કેનેડાના ઈમિગ્રેશન મિનીસ્ટર સીન ફેસરે કહ્યું હતું કે તે લેવાઈ રહેલા અર્થપૂર્ણ પગલાઓને કારણે ઈમિગ્રેશન પ્રક્રિયા ઝડપથી રાબેતા મુજબની થવાની આશા રાખી રહ્યા છે અને તેમણે અરજદારોને પણ સેવાઓ પહેલાની જેમ મળતી થવા માટે થોડો સમય રાહ જોવાની અપીલ કરી હતી. આ અઠવાડિયાના આરંભે મીડિયા સાથેની વિસ્તૃત મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, કોવિડ-૧૯ને કારણે લદાયેલા પ્રવાસ પ્રતિબંધોને પરિણામે ઈમિગ્રેશનની પ્રક્રિયા

ખોરંભે પડી હતી. પરંતુ હવે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે અમે પણ પ્રક્રિયામાં સુધારાઓ કરી રહ્યા છીએ અને વધારાના કર્મચારીઓ અને સાધનોના ઉપયોગથી અરજદારોની સુવિધાઓમાં વધારો કરી રહ્યા છીએ. ખાસ કરીને પ્રક્રિયાને ઝડપી બનાવી રહ્યા



છીએ. કેનેડામાં પરમેનન્ટ રેસીડેન્ટ માટેની અરજીઓનું પ્રમાણ વધુ છે અને કોવિડ-૧૯ શરૂ થયો ત્યારની બાકી અરજીઓનો ભરાવો પણ ઘણો વધી ગયો છે. જેનાથી પ્રક્રિયા ઝડપી બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હવે આશાનું કિરણ દેખાઈ રહ્યું

છે, એમાં કેનેડીયન સીટીઝનશીપની અરજીઓ માટેના અલગ ધોરણનો અમલ થશે. જેને કારણે અરજીઓનો નિકાલ ઝડપથી થઈ શકશે. હવે લગભગ બધી અરજીઓ ઓનલાઈન પ્રોસેસ થશે અને નવા સોફ્ટવેર પણ આવી ગયા છે. કર્મચારીઓની તંગીને પહોંચી વળવા અમે ૫૦૦ વધારાના કર્મચારીઓની નિમણૂક કરી છે. જેને માટે આઈઆરસીસીએ સરકાર પાસેથી ૮૫ મિલિયન યુએસડી અને ફેડરલ સરકાર પાસેથી ૩૮૫ મિલિયન યુએસડીની ફાળવણી કરાવી હોવાથી હવે કામ ઝડપી બની શકશે.

મૂળ નવસારીનો જશ શાહ હવે કેનેડા અંડર-૧૯ ટીમનું સુકાનીપદ સંભાળશે

નવસારી

કેનેડાની અંડર-૧૯ વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં મૂળ નવસારીના વતની અને રોટરી સંસ્થા સાથે જોડાયેલા કાંતિભાઈ શાહ પરિવારના પૌત્રનું ૮ માસ પહેલા સિલેકશન થતા શાહ પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી. હવે જશ શાહ કેનેડા અંડર-૧૯ ટીમનું નેતૃત્વ કરશે.



મૂળ નવસારીના અને કેનેડામાં આશરે ૧૭ વર્ષથી સ્થાયી થયેલા શાહ પરિવારનો પૌત્ર જશ હિમાંશુ શાહ કેનેડા ક્રિકેટ ક્લબમાં અંડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં ૮ માસ પહેલા સિલેક્ટ થયો હતો.

જે બાદ ક્રિકેટમાં સારું પ્રદર્શન જોઈને કેનેડા ક્રિકેટના અધિકારીઓએ જશ શાહની હવે અંડર-૧૯માં કેપ્ટન તરીકે પસંદગી કરી હતી. નવસારીમાં રહેતા કાંતિલાલ શાહનો પુત્ર હિમાંશુ શાહ કેનેડામાં મોટેલ બિઝનેસ કરે છે અને તેમને એક દીકરો અને દીકરી છે.

જે પૈકી દીકરો જશ શાહ હાલમાં ધોરણ-૧૨ પાસ કરીને બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે નવસારીના અન્ય એક ક્રિકેટર સિદ્ધ લાડની પસંદગી પણ ૮ માસ પહેલા કેનેડા અંડર-૧૯ની ટીમમાં પસંદગી થઈ હતી.

પાર્કિંગ ટિકિટની છટકબારીને રોકવા ટોરન્ટો વિસ્તારમાં લાઈસન્સ પ્લેટ સ્કેનર ગોઠવાશે

પ્રથમ તબક્કે જ પાર્કિંગ ટિકિટના વેચાણમાં ૩૦ યુએસ ડોલરનો વધારો નોંધાયો

ઓન્ટેરિયો

ટોરન્ટો પોલીસે પાર્કિંગ સિસ્ટમને વ્યવસ્થિત બનાવવા ટકનોલોજીનો ઉપયોગ કરીને પાર્કિંગ ટિકિટમાંથી છટકબારી રોકવા લાઈસન્સ પ્લેટ સ્કેનર ગોઠવવાનું નક્કી કર્યું છે. રેની જોન્સને સેન્ટ કલેર વિલેજની સડકો ઉપર જ્યારે આરંભ પાર્ક થયેલી કારોને જોઈ ત્યારે એમણે પાર્કિંગ સિસ્ટમને વ્યવસ્થિત કરવાનું વિચારી લીધું હતું. તેમણે કહ્યું

હતું કે લોકો હજુ પણ પાર્કિંગ ટિકિટ લેવામાંથી છટકબારી શોધી રહ્યા છે. તેમણે પાર્ક થયેલી કારોની પાર્કિંગ ટિકિટ છે કે નહીં અને એની સમયમર્યાદા પુરી તો નથી થઈને એ ચકાસવા લાઈસન્સ પ્લેટ સ્કેનર ગોઠવ્યા છે. જેના પરીણામે ૩૦ યુએસ ડોલરની પાર્કિંગ ટિકિટના વેચાણમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે એક કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે એક બ્લુ વાનની ટિકિટની સમય મર્યાદા પુરી થઈ હોવા છતાં એ પાર્ક થયેલી જોવા મળતા એને વધારાના ૧૦ યુએસ ડોલરનો દંડ ફટકારાયો હતો. જો કે લોકોની મુશ્કેલી પણ સમજી શકાય

એવી છે કે તેમણે કાર પાર્ક કર્યા બાદ ચાલીને બીજા બ્લોકમાં જવાનું હોવાથી સમય વધુ લાગતો હોય છે. ટીપીએસના અધિકારીઓએ કહ્યું હતું કે અમલમાં થોડી ચુક થઈ જાય છે. જેનો લાભ લોકો ઉઠાવતા હોય છે. હવેથી સ્કેનર ગોઠવ્યા હોવાથી સમય મર્યાદા પુરી થઈ હોય એવી કારોને પણ નંબર પ્લેટ સ્કેનરથી ઓળખી લેવાશે અને તેમની પાસેથી દંડ વસુલ કરી શકાશે. જેના પગલે હવે લોકો કોઈ છટકબારી નહીં શોધી શકે. ટોરન્ટો શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા વધુ યુસ્ત થાય તો ટ્રાફિકનિયમન પણ વ્યવસ્થિત બની શકશે.

ઈટોબિકોક બાલક્રિષ્ણા સત્સંગ મંડળ દ્વારા 'નાવ મનોરથ'ની ભવ્ય ઉજવણી



વૈષ્ણવે પોતપોતાના ઠાકોરજી સાથે પધારીને નાવ મનોરથનો લાભ લીધો

સુમધુર કિર્તન સાથે નાવ મનોરથથી વાતાવરણ ભક્તિમય થઈ ગયું

ઈટોબિકોક

કોરોના કાળ દરમિન અઠવાડિક સત્સંગ online ઉજવતી વખતે જ નક્કી કરવામાં આવ્યા મુજબ ગત ૨૬મી જૂને રવિવારે બાલક્રિષ્ણા સત્સંગ મંડળ, ઈટોબિકોક દ્વારા નાવ મનોરથની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વૈષ્ણવજનોના સહકારથી ૪૯ Silverstone dr ના

party hall ખાતે આયોજિત કાર્યક્રમમાં દરેક વૈષ્ણવે પોતપોતાના ઠાકોરજી સાથે પધારીને નાવ મનોરથનો લાભ લીધો હતો. ઠાકોરજીના સુમધુર કિર્તન સાથે નાવ મનોરથથી વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું. આયોજકોએ નાવ મનોરથ માટેની જરૂરી વ્યવસ્થા, ઠાકોરજી માટે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ અને મહાપ્રસાદી તેમજ ભેટની વ્યવસ્થા કરી હતી.

સત્સંગમાં સહભાગી થઈને સૌએ આનંદોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે કલા-સંગીત, ગાયન-વાદનથી સત્સંગ સમયે લગભગ ૧ વર્ષ સુધી સહયોગ આપનારા ચંદ્રકાંતભાઈ ઠાકર, પ્રમેશભાઈ નંદી, યશ પટેલ તેમજ ઉમેશભાઈ પટેલનો આયોજકોએ આભાર માન્યો હતો. મુખ્ય આયોજકો રાજેશ શાહ, ઈન્દ્રવદન શાહ, સંજય શાહ, અચિન રેન્નીંગા તથા ચેતન શાહ તેમજ શીલા મર્યેન્ટે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

THINKING OF

BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.
મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

#1

RE/MAX
CROSSROADS REALTY INC.
#SellwithABOWATH
your Local REALTOR

તંત્રી સ્થાનેથી

SCના ફરમાન પછી ઉદ્ધવ પાસે રાજનામા સિવાય આરો ન હતો

મહારાષ્ટ્રના રાજકારણમાં 15 દિવસ સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો. બુધવારે સાંજે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા આદેશ આપ્યા બાદ મોડી સાંજે ઠાકરેએ મુખ્યમંત્રી અને સભ્યપદેથી રાજનામું ધરી દીધું હતું. આમ તો સરકાર બચાવવા માટે તેમણે છેલ્લે સુધી પ્રયાસો કર્યા પરંતુ સફળ થયા નહીં.



તંત્રી - પ્રકાશક સ્વદેશ

15 દિવસ પહેલા જ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને એકનાથ શિંદે સહિત 38 ધારાસભ્યો સુરત અને ત્યારબાદ ગૌવહાટી ચાલ્યા ગયા હતા. જે બાદ તેમને મનાવવા શિવસેનાએ દરેક પ્રકારે યુક્તિઓ અજમાવી પરંતુ ભાજપ સાથે ભેગા થઈ ગયેલા આ અસંતુષ્ટો માન્યા નહીં.

આમ તો અઢી વર્ષ પહેલા મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપ અને શિવસેના યુતિને 161 બેઠકો મળી. જે સરકાર રચવા માટે પર્યાપ્ત હતી. પરંતુ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓએ તેમની પાર્ટીમાંથી કોઈને મુખ્યમંત્રી પદ આપવાનું અમીત શાહે વચન આપ્યું હોવાનો દાવો કરતા ભાજપ બગડી ગઈ હતી. સામે પક્ષે ભાજપે નમતુ નહીં જોખતા શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના સહકારથી મહાવિકાસ અઘાડી સરકાર બનાવી હતી. બસ ત્યારથી જ આ સરકારને ગબડાવવા ભાજપ પેતરા રચતો રહ્યો હતો. ભાજપના મનમાં છેલ્લા અઢી વર્ષની મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર કણાની માફક ખુંચી રહી હતી. કારણ કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે. આવા સંજોગોમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન તે ઈચ્છતો હતો. પરંતુ અઘાડી સરકાર બે રોકટોક ચાલી રહી હતી.

આખરે અઢી વર્ષનો કાર્યકાળ પુરો થતાં જ શિવસેનાએ હવે એનસીપીને સીએમ પદ આપવાનું હતું આ સંજોગોમાં શિવસેનાના ધારાસભ્યોમાં અને મંત્રીઓમાં ઠાકરે સરકારની નીતિ સામે પ્રવર્તતો અસંતોષ જોઈ ભાજપે ખેલ કરવાનું નક્કી કરી નાંખ્યું હતું. આ તરફ ઠાકરે સામે બળવો કરનારા ધારાસભ્યોને પણ ખ્યાલ આવી ગયો હતો કે, આવનારી ચૂંટણીમાં તેમને જીતવું મુશ્કેલ છે. કારણ કે, અઘાડી સરકારમાં તેમની પાર્ટીની મુખ્ય હિંદુત્વની વિચારધારાને કારણે મુકી દેવાયાની લાગણી તેઓને થતી હતી. આ ઉપરાંત ઠાકરે સરકારમાં તેમનું વજન ઘટતું જઈ રહ્યું હતું. બસ આ તકનો લાભ લઈને ભાજપે શિવસેનામાં બળવો કરાવી નાંખ્યો અને ઉદ્ધવ સરકારને લઘુમતિમાં મુકી દીધી. રાજકીય સાથે કાનૂની મોરચે પણ ઠાકરે જૂથે સુપ્રિમ કોર્ટમાં લડત આપી પરંતુ પોતાના જ બળવાખોર સભ્યોને મનાવવામાં તેઓ નિષ્ફળ ગયા અને ફ્લોર ટેસ્ટની વાત આવતાં જ ઠાકરેએ રાજનામા આપી દીધું.

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવાર રાતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને ઉદ્ધવ ઠાકરે સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની માગણી કરી એ વખતે જ નક્કી થઈ ગયેલું કે, ઉદ્ધવે આજે નહીં તો કાલે વાસ્તવિકતાનો સામનો કરવાનો થવાનો છે અને પોતાની પાસે બહુમતી છે એ સાબિત કરવું પડશે.

આ જ સમયે ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવતા ગુવાહાટીમાં શિવસેનાના ધારાસભ્યો

સાથે અઠવાડિયાથી ધામા નાંખીને પડેલા બાગી નેતા એકનાથ શિંદેએ પણ મુંબઈ આવવા રવાના થવાનું એલાન કરી નાખ્યું હતું. શિંદેએ બુધવારે જ મુંબઈ આવવાનું એલાન કરેલું પણ પછી પ્લાન ચેઈન્જ કરીને બળવાખોર ધારાસભ્યોને પહેલાં ગોવા અને પછી ગુરુવારે વહેલી સવારે મુંબઈ લવાશે એવું નક્કી કરાયું હતું. ગોવાની ફાઈવ સ્ટાર હોટલમાં ૭૧ રૂમ પણ બૂક કરી દેવાયા હતા એ જોતાં બળવાખોર ધારાસભ્યો સવારે ૧૧ વાગ્યે વિધાનસભાનું સત્ર શરૂ થાય એ પહેલાં જ મુંબઈમાં પધરામણી કરશે એવો તખ્તો ગોઠવાયેલો. તેના કારણે શિવસેનાના ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાની ઉદ્ધવની રહી સહી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું.

રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ભાજપના જૂના જોગી છે, તેથી ભાજપની માગણીને એ સ્વીકારશે જ તેમાં મીનમેખ નહોતો. આ ધારણા સાચી પડી ને ભાજપે અવિશ્વાસનો પ્રસ્તાવ વિધાનસભામાં લાવવાની માગણી કરી તેના ૧૨ કલાકમાં તો રાજ્યપાલે માગણી મંજૂર પણ કરી નાંખી. ભગતસિંહ કોશિયારીએ ગુરુવારે સવારે ૧૧ વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. સાથે સાથે ચોખવટ પણ કરી નાંખી કે, ૩૦ જુલાઈ એટલે કે ગુરુવારના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં બળાબળનાં પારખાં થશે.

વિધાનસભાનું સત્ર સવારે ૧૧ વાગ્યે શરૂ કરીને સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોઈ પણ સ્થિતિમાં આખી પ્રક્રિયા આટોપી લેવામાં આવે એવું ફરમાન પણ રાજ્યપાલે કરી નાંખ્યું હતું. શિવસેનાએ રાબેતા મુજબ જ રાજ્યપાલના આદેશ અંગે કકળાટ કર્યો અને શિવસેનાએ બળાબળનાં પારખાં કરવાના રાજ્યપાલના આદેશને ગેરબંધારણીય ગણાવીને તેને સુપ્રીમમાં પડકાર્યો પરંતુ કોર્ટે ગુરુવારે જ વિશ્વવાસનો મત લેવા ફરમાન કરતાં ઉદ્ધવ પાસે લડી લેવા સિવાય કોઈ આરો રહ્યો નહોતો. ઉદ્ધવ જે રીતે હાકલાપડકારા કરતા હતા એ જોતાં લાગતું હતું કે, એ છેલ્લી ઘડી લગી લડી લેશે પણ તેના બદલે એ પાણીમાં બેસી ગયા. સુપ્રીમના આદેશના પગલે વિશ્વવાસનો મત લીધા વિના છૂટકો ના રહેતાં રાજનામું ધરીને મેદાન છોડી દીધું.

સુપ્રીમ કોર્ટે આ ફરમાન કરશે એ નક્કી જ હતું કેમ કે, ૨૦૧૮માં કણાટકમાં થયેલા ભવાડા વખતે સુપ્રીમ કોર્ટે ભાજપના ચેદુરપ્પાના મામલે આ જ વલણ લીધું હતું. કણાટકમાં ભાજપના વજુભાઈ વાળા રાજ્યપાલ હતા. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી, પણ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. આમ છતાં કોંગ્રેસ-જેડીએસએ પહેલાં જ જોડાણની જાહેરાત કરીને સરકાર રચવા દાવો કર્યો હતો.

વજુભાઈએ કોંગ્રેસ-જેડીએસ પાસે ભાજપ કરતાં વધારે ધારાસભ્યો હોવા છતાં ભાજપને સરકાર રચવા નોતરું આપીને ચેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. વજુભાઈના આ નિર્ણય સામે કોંગ્રેસ-જેડીએસએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આક્ષેપ મૂક્યો કે, રાજ્યપાલે બંધારણીય જોગવાઈ અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો ભંગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ચેદુરપ્પાને તાત્કાલિક એટલે કે બીજા જ દિવસે વિશ્વવાસનો મત રજૂ કરવા આદેશ કર્યો

અનુસંધાન પેજ નં. 16

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

✓ Cockroach

✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI

✓ Animal Control

✓ Bird Control

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926
 Government Licensed Structural Exterminator

DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :

One to One Individual and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
 IG & FB: @divineyogabygeeta

ભાભરના ખારા ગામે એક કોમના 2 જુથ વચ્ચે લોહિયાળ અથડામણ

ટોમી, લોકડી, કાતરી, ધારિયા જેવા તિક્ષણ હથિયારોથી સામ-સામે હુમલો કરતા એક મહિલા સહિત સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

ભાભર

ભાભર તાલુકાના ખારા ગામે અદાવતના કારણે બે જુથો સામસામે આવી ગયા હતા. જેમાં પ્રાણઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર હુમલો થતાં 7 ઈસમોને ઈજાઓ પહોંચી હતી. બન્ને પક્ષોના 24 શખસો વિરુદ્ધ ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



ખારા ગામે રવિવારના રોજ જુની અદાવતને લઈ એક જ કોમના બે જુથો વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો. આ જુથ અથડામણમાં ટોમી, લોકડી, કાતરી, ધારિયા સહિત તિક્ષણ હથિયારો વડે હુમલો કરતા એક મહિલા સહિત સાતથી વધુ ઈસમોને ઈજાઓ થવા પામી હતી. જેની જાણ ભાભર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ઘયલોને 108

એમ્બ્યુલન્સ દ્વારા ભાભર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. ભાભર પોલીસ મથકે વેલાભાઈ ચમનાભાઈ ઠાકોર અને વેરસીજી હેમતજી ઠાકોર આમ બન્ને જુથના ઈસમોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામસામે 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

ખેરાલુના મોટી હિરવાણી ગામે ભાજપને ચેતવણી આપતું બેનર લાગતાં દોડધામ

વિસનગરના ગુંજાળામાં ઋષિકેશ પટેલનો વિરોધ કરતાં પોસ્ટર્સ લાગ્યા

મહેસાણા

ખેરાલુના હિરવાણીમાં દૂધસાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજી ચૌધરી ઉપર હુમલાના વિરોધમાં ભાજપને ચેતવણી આપતું બેનર લગાવાયા છે. વિસનગરની આઈટીઆઈ ચોકડી પાસે દૂધસાગર ડેરીનું અજાણ્યા શખ્સે પોસ્ટર ફાડ્યું હતું. જ્યારે ગુંજાળા ગામમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો વિરોધ કરતા પોસ્ટર્સ લાગતાં ભાજપના નેતાઓમાં દોડધામ મચી છે. દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ

સભા સમયે પૂર્વ વાઈસ ચેરમેન ઉપર થયેલા હુમલા મુદ્દે શરૂ થયેલું રાજકારણ શમવાનું નામ લેતું નથી. ખેરાલુના મોટી હિરવાણી ગામમાં ભાજપને જાહેર ચેતવણી ઉલ્લેખીને બેનર લગાવી તેમાં મોંઘજી ચૌધરી અને તેમના પુત્ર ઉપર થયેલા હુમલાનો વિરોધ કરીને એફઆઈઆર અને કલમ ૩૦૭ ૨૯ નહીં કરાય તો ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપીને તેનું પરિણામ આગામી ચૂંટણીઓમાં ભોગવવાનો વારો આવવાની ચીમકી આપી છે.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial
24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets



Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા કચોરી, સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)
\$9.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)
\$7.50 +Tax



CATERING SPECIAL

\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

આણંદમાં પાણી તેમજ બંધ સ્ટ્રીટ લાઈટ મામલે પાલિકાના ઘેરાવ સાથે હલ્લાબોલ

કચેરીમાં જ ઘરણાં યોજીને સૂત્રોચ્ચાર કરતા તંત્રના સત્તાધિશો-અધિકારીઓ ડઘાયા

આણંદ

આણંદ શહેરના વોર્ડ નં.૧ તથા ૨માં વરસાદી પાણીના નિકાલના પ્રશ્ન અંગે તેમજ વોર્ડ નં.૩ અને ૪માં છેલ્લા એક માસથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના મામલે આજે કાઉન્સિલરો સહિત સ્થાનિકોએ પાલિકાના ઘેરાવો કરી હલ્લાબોલ કર્યો હતો. કાઉન્સિલરો સહિત સ્થાનિકો ચીફ ઓફીસરની કેબીનમાં ધસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે ધરણા કરી ઉગ્ર રજૂઆત કરી હતી. અલગ-અલગ

વોર્ડના રહીશો દ્વારા પાલિકા ખાતે વિરોધ વ્યક્ત કરવામાં આવતા પાલિકા સંકુલ ખાતે મંગળવારે વિરોધના અખાડા જેવો ઘાટ સર્જાયો હતો.

વોર્ડ નં.૧માં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીના નિકાલ અંગે અનેકવાર પાલિકા સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરવા છતાં આ અંગે કોઈ નિરાકરણ ન આવતા આખરે વોર્ડ નં.૧ની મહિલાઓએ આજે આણંદ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો. વોર્ડ નં.૧ના કાઉન્સિલર સહિત સ્થાનિક

રહીશો દ્વારા વરસાદી પાણીના નિકાલ પ્રશ્ને ચીફ ઓફીસરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કચરાના ઢગ સહિત વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો હલ થતા નથી. બીજી તરફ વોર્ડ નં-૩ અને ૪માં છેલ્લા એક માસ ઉપરાંતથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જેના પગલે સ્થાનિકોને રાત્રિના સુમારે અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે.

ડાયનાસોર મ્યુઝિયમથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે મોટી સિદ્ધિ : સીએમ

બાલાસિનોર

મહીસાગર જિલ્લો તેના અદ્ભુત કુદરતી સૌંદર્યને કારણે પ્રવાસન ક્ષેત્રના વિકાસની અનેક સંભાવનાઓ ધરાવે છે. રાજ્ય સરકારે પ્રવાસન દ્વારા સ્થાનિકોને રોજગારી મળે, જિલ્લાની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળે તેવા હેતુથી મહીસાગર ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનું આયોજન હાથ ધર્યું છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આગામી ત્રણ વર્ષમાં કડાણા એરિયા ડેવલપમેન્ટ, સ્વરૂપ સાગર લેક ડેવલપમેન્ટ, કલેશ્વરી ડેવલપમેન્ટ, કેદારેશ્વર ધામોદ ડેવલપમેન્ટ, માનગઢ હિલ ડેવલપમેન્ટ તેમજ ગલતેશ્વર

ડેવલપમેન્ટ, ડાકોર ડેવલપમેન્ટ જેવા અનેક કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડાયનાસોર મ્યુઝિયમ ફેઈઝ-૨ પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપીને રાજ્યમાં ટુરિઝમ સેક્ટરનો અમૃતકાળ લાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. રૈયોલીનું આ ડાયનાસોર પાર્ક ગુજરાત, દેશ અને વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે એટલું જ નહીં, ડાયનાસોરની સૃષ્ટિમાં રસ ધરાવતા સંશોધકો અને યુવાનો માટે આ સ્થળ રસપ્રદ બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડોદરામાં પ્રેમીના પ્રેમમાં અંધ માતાએ પુત્રની હત્યા કરી લાશ થાંભલે લટકાવી

વડોદરા

સાવલી તાલુકાના પસવા ગામમાં રહેતી સુમિત્રા પરમાર વેજલપુર ગામમાં રહેતા કિશન મનહર રાવળ સાથે લગ્નેતર સંબંધો રાખતી હતી. પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધોની જાણ પતિ મુકેશને થતા તેને પત્નીને ઠપકો આપતા પત્નીએ બધાને મારી નાખી પ્રેમી સાથે ભાગી જવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ સુમિત્રા તેના 6 વર્ષનાં માસૂમ પુત્ર પ્રિન્સને ઘેરથી લઈ ગઈ હતી અને પુત્રની કોઈ કપડાથી ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પુત્રની લાશને કેનાલ પાસેના થાંભલા પર લટકાવી માતા ફરાર થઈ ગઈ હતી. આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં પુત્રની હત્યા કરનાર માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હાલોલમાં પિતાએ પુત્રને ફટકારતા સારવાર બાદ મોત: હત્યાનો ગુનો

વડોદરા

હાલોલના પાંચકોબલા ગામમાં પિતા પુત્ર વચ્ચે થયેલી તકરારમાં પિતાએ પુત્રના મોઢાના ભાગે તિક્ષણ વસ્તુ ફટકારતા પુત્રનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


હાલોલ ખાતે પિતાએ પુત્રની હત્યા કર્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ પાંચ કોબલા વિસ્તારના સરપંચ

ફળિયામાં રહેતા 35 વર્ષીય સંજયભાઈ કનુભાઈ બારીયાની કોઈક કારણોસર પિતા કનુભાઈ બારીયા સાથે તકરાર થઈ હતી. તે સમયે પિતાએ શિક્ષણ વસ્તુ પુત્રના મોઢે મારતા સંજયભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી બેભાન અવસ્થામાં વધુ સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સર્જરી વિભાગમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજવા ડેમના વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલી વૃદ્ધા પર મગરનો હુમલો

વડોદરા

આજવાના ખેડા કરમસિયા ગામે રહેતા ૬૦ વર્ષની વૃદ્ધા રચજીબેન રાઠોડિયા અને કેલાસબેન રાઠોડિયા ગઈકાલે આજવા ડેમ વિસ્તારમાં રોજની જેમ બકરા ચરાવવા ગયા હતા.બકરાઓને પાણી પીવડાવવા માટે તેઓ પાણીની નજીક લઈ ગયા હતા.તે સમયે એક મગરે હુમલો કરી રચજીબેનનો પગ પકડી લીધો હતો.મગર રચજીબેનને પાણીની અંદર ખેંચી જતો હતો. કેલાસબેને રચજીબેનનો હાથ પકડી બહારની તરફ ખેંચવા લાગ્યા હતા.છેવટે રચજીબેનનો પગ મગરે છોડી દીધી હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે સૌપ્રથમ જરોદ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે તેઓને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
Broker

સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બાધારૂપ દુકાનો હટાવવા હાઈકોર્ટની લીલીઝંડી

મનપા જાહેરહિતમાં દુકાનો ખાલી કરાવે છે, આ પ્રોજેક્ટમાં વિલંબ શક્ય નથી: કોર્ટ

સુરત

સુરતના બહુ મહત્વના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અંતરાયરૂપ એવા રૂદરપુરા શોપીંગ કોમ્પ્લેક્સ દુકાનો હટાવવા આખરે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના હુકમ મારફતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટના આ હુકમને પગલે છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે આગળ ધપી શકશે. સુરત મનપાના દુકાનો ખાલી કરાવવા અંગેના હુકમને



પડકારતી દુકાનદારો તરફથી કરાયેલી રિટ અરજીઓ હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયાએ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, સુરત મનપા જાહેરહિતમાં દુકાનો ખાલી કરાવવા માંગે

છે અને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા મુજબ, આ પ્રકારના મેગા પ્રોજેક્ટમાં વિલંબ થાય તે યોગ્ય ના કહેવાય, કારણ કે, આવા વિલંબથી ઘણું નુકસાન થતું હોય છે. સુરત મનપા તરફથી મહત્વની દલીલો કરતાં જણાવાયું હતું કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અને સુરતના બહુ મહત્વના એવા મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂદરપુરા શોપીંગ સેન્ટરની દુકાનો ખાલી કરાવવા માટે સુરત મનપા સત્તાધીશો દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૧માં હુકમ કરાયો છે, તે જાહેરહિતમાં લેવાયોલો નિર્ણય છે.

ગ્રીષ્મા હત્યા કેસ: આરોપી ફેનીલને ફાંસીની સજા સામે કોર્ટમાં અપીલ

સુરત

રાજ્યભરમાં ભારે ખળભળાટ મચાવનાર સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનીલ ગોયાણીએ આખરે નીચલી કોર્ટે તેને ફટકારેલી ફાંસીની સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી કિમીનલ અપીલ મંગળવારે હાઈકોર્ટે દાખલ કરી હતી. જો કે, કેસની સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તરફથી હાઈકોર્ટને અનુરોધ કરાયો હતો. જો કે, હાઈકોર્ટે તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારી પહેલાં અન્ય કેસોમાં સજા પામેલા દોષિતો દસ-બાર વર્ષથી જેલમાં છે અને તેઓની સજા સામેની અપીલો ઓલરેડી પેન્ડીંગ છે

ત્યારે તમારી અપીલ સાંભળવામાં પ્રાથમિકતા આપી શકાય નહીં.

સુરતમાં ગત ફેબ્રુઆરી મહિનામાં ૨૧ વર્ષીય ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની એકતરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનીલ ગોયાણીએ ગળાના ભાગે ઠંડા કેલેજે ચપ્પુ ચલાવી જાહેરમાં કરપીણ હત્યા કરી હતી, જેને લઈ સુરત સહિત ગુજરાતભરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ચકચારભર્યા એવા આ કેસમાં સુરત સેશન્સ કોર્ટે તા.૫ મેના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આરોપી ફેનીલને ફાંસીની મહત્તમ સજા ફટકારી હતી.

સુરતમાં મિક્સ એપિડેમિક થવાની સંભાવના: ડેન્ગ્યુ, મેલેરિયા, તાવના કેસ વધ્યા

સુરત

સુરત :સુરત શહેરમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં અનેક જોઈંટગી ગુમાવી અને હવે કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા વચ્ચે કેસમાં ઉછળાણો આવી રહ્યા છે. બીજી તરફ વરસાદના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા, તાવના કેસ પણ વધી રહ્યા છે. એટલે એક સાથે મિક્સ એપિડેમિક શરૂ થવાની શક્યતા ડોક્ટર દર્શાવી રહ્યા છે. સુરતમાં કોરોના વધી રહ્યા છે. જેથી કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા છે. જેથી નવી સિવિલ અને મ્યુનિ.ની સ્મીમેર હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવી વિવિધ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. નવી સિવિલના મેડિસિન વિભાગના ડૉ.આકાશ પટેલે જણાવ્યું કે, હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ખેરગામમાં પૈસા માગતાં પુત્રની સગા પિતા દ્વારા ફુહાડીના ઘા ઝીંકી હત્યા

નવસારી

ખેરગામ તાલુકાના નારણપોર ગામે પિતા હેવાન બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં પિતા ભગુ પટેલે બુધવારે વહેલી સવારે ૨૦ વર્ષીય પુત્ર ગણેશ પર ઊંઘમાં જ ઘાતકી હુમલો કર્યો હતો. ફુહાડીના ઘા માથાના ભાગે વાગતાં ઊંઘમાં જ રામ રમી ગયા હતા. જે મામલે ખેરગામ પોલીસને જાણ થતાં દોડતી થઈ હતી.

હત્યા અંગે પ્રાથમિક તારણની વાત કરવામાં આવે તો પુત્ર ગણેશ બેરોજગાર હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની

માગણી કરતો હતો. પિતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતા હતા. ત્યારે સંભવિત રીતે પિતા ભગુ પટેલ પુત્રની પૈસા માગવાની હરકતથી કંટાળ્યા હતા અને આજે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પુત્રની હત્યા કરી હતી. હાલમાં કળિયુગમાં પિતા-પુત્ર સહિત પરિવારના સંબંધોની ગરિમા લજવાઈ છે. તેને કારણે આવા પ્રકારના બનાવો વધી રહ્યા છે. સમગ્ર ઘટનાક્રમ બનતા જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને પુત્રની લાશને પીએમ માટે સિવિલ ખસેડી છે.

૬ ઈંચથી વધુ વરસાદ વલસાડમાં ખાબકતા ચારેબાજુ પાણી પાણી

વલસાડ

વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે વલસાડ જિલ્લાને જાણે મેઘરાજાએ ધમરોળ્યો હતો. ગત રાત્રે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાતભર મેઘરાજાની જોરદાર બેટિંગને કારણે વલસાડ શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે વલસાડ શહેરમાં છ ઈંચથી વધારે વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ગુરુવારે સવારે ૬ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૪૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતું.

SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION

SPOUSAL SPONSORSHIP
SPECIALIST (98 percent success ratio)

Last minute student admission

Please contact us on
416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton

- Fanshawe
- Georgian
- Algoma
- Canadore

- Algoma
- Saskatchewan polytechnic
- Mohawk

ONLINE IELTS SPOKEN ENGLISH CLASSES ON ZOOM

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS / DETENTION REVIEWS / CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

CANADA 94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855

VADODARA 101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817

AHMEDABAD 139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

: Specialized in :

Job Offer & LMIA
Entrepreneur
Investor Business
Self Employed
Farm Investor

Email.: info@siis.ca Website.: www.siis.ca



જોની ડેપને એક ફિલ્મ માટે 2355 કરોડની મળી ઓફર

હોલીવુડ સ્ટાર જોની ડેપ છેલ્લા કેટલાય દિવસોથી ઘણો ચર્ચામાં રહ્યો હતો. એમ્બર હર્ડ સાથે તેના ઘરેલુ હિસાના આરોપોથી ઘેરાઈ ગયા બાદ તેની ચર્ચા અમેરિકાથી લઈને ભારત સુધી પૂબ જ થઈ હતી. તે ફરીથી પાર્ફરમના પાત્રમાં જોવા મળી શકે છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં જોની ડેપને ફરીથી કાસ્ટ કરવા માટે 2355 કરોડની ઓફર મળી છે. આટલું જ નહીં, માફી પત્ર પણ મોકલવામાં આવ્યો હતો જેમાં તેને ફિલ્મમાંથી બહાર કાઢવા બદલ માફી માંગવામાં આવી છે. હવે આ માફી સ્વીકારીને, જોની ડેપ આ ફિલ્મમાં પરત ફરશે.



સ્પર્દેશ

FRIDAY, 01 JULY, 2022

09

કાજોલ અને સૂર્યા સહિત પાંચ ભારતીય ઓસ્કર કમિટીમાં સામેલ



હોલીવુડ અભિનેત્રી કાજોલ તથા જય ભીમ જેવી ફિલ્મોથી ભારતભરમાં જાણીતા થયેલા તમિલ સ્ટાર સૂર્યાને ઓસ્કર કમિટીમાં સ્થાન મળ્યું છે. તેમને આવતાં વર્ષના ઓસ્કર એવોર્ડ માટે મતદાન કરવાનો અધિકાર મળશે. ઓસ્કરનું સંચાલન કરતી એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા વિશ્વભરની ૩૯૭ સેલિબ્રિટીને કમિટીમાં સ્થાન અપાયું છે. તેમાં ભારતમાંથી કાજોલ અને સૂર્યા ઉપરાંત ફિલ્મ રાઈટર રીમા કાગતી તથા ફિલ્મ સર્જકો સુશિમ્ત ઘોષ અને રિન્ટુ થોમસનો સમાવેશ થાય છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આ વરસે આમંત્રિત કરવામાં આવેલા ૩૯૭ નવા સદસ્યોમાં અભિનેત્રી કાજોલ, સૂર્યા ઉપરાંત ભારતના ફિલ્મ નિર્માતા સુશિમ્ત ઘોષ, રિન્ટુ થોમસ, રીમા કાગતી અને પાન નલિનનો સમાવેશ છે. મૂળ ગુજરાતી અમેરિકન ડિરેક્ટર પાન નલિનનો પણ આ કમિટીમાં સમાવેશ થયો છે. એક દાવા અનુસાર તેઓ કદાચ આ કમિટીમાં સ્થાન મેળવનારા પહેલા ગુજરાતી હોઈ શકે છે.

અવિકા ગૌર હોરર ફિલ્મ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કરશે



નવી મુંબઈ: કલર્સની સિરિયલ બાલિકા વધુથી લોકપ્રિયતા મેળવનાર સૌની લાડકવાઈ આનંદી હવે ફિલ્મોમાં જોવા મળશે. અવિકા ગૌર હવે બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. બોલીવૂડની એક હોરર ફિલ્મમાં અવિકા ગૌર અભિનય કરશે. એક્ટ્રેસ અવિકા ગૌર હવે મહેશ ભટ્ટની હોરર ફિલ્મમાં કામ કરશે. આ પહેલાં અભિનેત્રી તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકી છે. અવિકા ગૌર તેના બોલીવૂડ ડેબ્યુ વિશે જણાવે છે કે, 'ફિલ્મનું નામ '1920: હોર્સ ઓફ ધ હાર્ટ' છે અને હું તેની આનુભવિક રાહ જોઈ રહી હતી કારણ કે મારા દર્શકો હિન્દી ફિલ્મોમાં મારા લોન્ચની રાહ જોઈ રહ્યા હતા અને છેવટે એ સમય આવી ગયો છે. આ ફિલ્મની સ્ટોરી મહેશ ભટ્ટ સરે લખી છે, વિક્રમ ભટ્ટ અમારા નિર્માતા છે અને કૃષ્ણ ભટ્ટ અમારા દિગ્દર્શક છે. હું બોલીવૂડમાં આ નવી સફરની રાહ જોઈ રહી છું. હું ઘણી ખુશ છું.' લીડ એક્ટ્રેસ તરીકે આ મારી પહેલી ફિલ્મ છે અને હું આનાથી વધુ સારી ફિલ્મની કલ્પના કરી શકતી નથી. મહેશ ભટ્ટ જે પણ કરે છે તે ખાસ જ હોય છે, ખાસ કરીને હોરર અને 1920 ની આ ફેબ્રુઆરી સાથે કે હું આ તક મેળવીને ધન્ય અનુભવું છું.' અવિકા ગૌર વિશે જ્યારે તેની સફળતાનો મંત્ર પુછવામાં આવ્યો ત્યારે, અવિકા ગૌર કહે છે કે, "માત્ર હું દિવસના અંત સુધીમાં પોતાને ખુશ રાખવાનો છે, મને લાગે છે કે, હું મારુ બેસ્ટ આપુ છું, હું પોતાને હંમેશા પ્રેરિત કરતી રહું છું.




કંગના રાનૌત સામે જાવેદ અખ્તરે કરેલા માનહાનિ કેસમાં ચાર જુલાઈના રોજ મુંબઈ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ પહેલાં કંગનાને 27 જૂનના રોજ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તે કોર્ટ આવી નહોતી. ત્યારબાદ જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે કોર્ટને કહ્યું હતું કે કંગના સુનાવણી દરમિયાન હાજર રહી નથી, આથી જ તેની વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવે.કંગનાના વકીલ રિઝવાને કહ્યું હતું કે એક્ટ્રેસ ચાર જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેશે. કેસની સુનાવણી ચાર જુલાઈની સાંજે ચાર કંગના મુંબઈ કોર્ટમાં હાજર ના થાય તો બિનજામીનપાત્ર વોરંટ વાગે થશે. વર્ષ 2020માં કંગનાએ જાવેદ અખ્તર વિરુદ્ધ વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું હતું. પછી જાવેદે કંગના તેમની ઈમેજને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. જાવેદે કોર્ટમાં કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. સુનાવણી અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં શરૂ થઈ હતી.



શાહરુખની ડોન શ્રીમાં કામ કરવા એડલ્ટ સ્ટાર કેન્દ્રા ઉત્સુક

મુંબઈ : શાહરુખ ખાનની ડોન શ્રી અંગે અટકળોનો દોર જારી છે. આ સમયે એડલ્ટ સ્ટાર કેન્દ્રાએ પણ ડોન શ્રીમાં કામ કરવા માટે પ્રપોઝલ મોકલી છે. કેન્દ્રા શાહરુખની બહુ મોટી ફેન છે. તે અવારનવાર શાહરુખની ફિલ્મો તથા અન્ય બાબતો અંગે સોશિયલમીડિયા પર પોસ્ટ કરતી હોય છે. કેન્દ્રાએ ડોન શ્રીના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિંઘવાનીને ટેગ કરીને સામેથી પ્રપોઝલ મોકલી છે. તેણે લખ્યું છે કે પબ્લિક ડિમાન્ડ છે કે ડોન શ્રી બનવી જ જોઈએ અને મારે પણ એનો હિસ્સો બનવું છે. જોકે, તેની આ દરખાસ્ત વિશે મેકર્સ કેટલા ગંભીર છે તે અંગે કશું જાણવા મળ્યું નથી. જોકે, બોલીવૂડમાં ચર્ચા છે કે વાસ્તવમાં જો આ એડલ્ટ સ્ટાર સાથે કોઈ ટૂંકા રોલ અથવા તો આઈટમ સોન્ગ માટે કોલબરેશન કરવામાં આવે તો તે ફિલ્મની એક હાઈલાઈટ બનશે. અમિતાભ બચ્ચન આ ફિલ્મનો હિસ્સો હશે એવું મનાઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અમિતાભ ડોન ફિલ્મને લગતી પોસ્ટ કરે છે. તાજેતરમાં તેમણે પોતે ડોનના પોસ્ટર પર ઓટોગ્રાફ આપતા હોય અને તેમની સાથે શાહરુખ હોય તેવી એક તસવીર પણ પોસ્ટ કરી હતી. અમિતાભ જેવા પ્રોફેશનલ એક્ટર વગર કારણે ડોનને આટલી હાઈલાઈટ કરે નહીં તેવું જાણકારો માને છે.

માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અંગે પણ બાયોપિક બનશે



મુંબઈ : વાર્તાઓની ભારે તંગી અનુભવતાં બોલીવૂડમાં લગભગ દરેક બીજી ફિલ્મ સિક્વલ, બાયોપિક કે રીમેક જ હોય છે. હવે માજી વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જીવનકથા પરથી પણ ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ છે. નિર્માતા સંદીપ સિંહ સ્વ. અટલ બિહારી બાજપાથી પર ફિલ્મ બનાવવાના છે. જેનું નામ અટલ રાખવાના છે. આ ફિલ્મનું એક પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યું છે. જેના પર વાજપેયીની પ્રસિધ્ધ પંક્તિઓ મેં રહુંં યા ન રહુંં દેશ રહના યાહિયે જોવા મળી રહી છે. આ ફિલ્મ અટલજીની પર લખેલ પુસ્તક ધ અનટોલ્ડ વાજપેયી : પોલીટિશિયન એન્ડ પેરાડોક્સ પર આધારિત હશે. આ ફિલ્મમાં તેમની જીવન સફરને દર્શાવવામાં આવશે. આવતાં વર્ષે નાતાલના દિવસે વાજપેયીનો ૯૯મો જન્મદિવસ હશે. ત્યારે આ ફિલ્મ રિલીઝ કરવાની યોજના છે.

અવર બેબી કમિંગ સૂન : મમ્મી-ડેડી બની રહ્યાની અલિયા-રણબીરની જાહેરાત

લગ્નને હજુ ત્રણ મહિના પણ પૂરા થાય તે પહેલાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેઓ પેરેન્ટ્સ બની રહ્યાની જાહેરાત કરી છે. અવર બેબી કમિંગ સૂનના કેપ્શન સાથે આલિયાએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર સોનોગ્રાફી કરાવતી તસવીર શેર કરી હતી. આલિયાની આ જાહેરાત સાથે જ સમગ્ર બોલીવૂડ હરખના હિલ્લોળે ચઢ્યું હતું. દાદી નીતુ કપૂર, ફઈ રિદ્દિમાં, આલિયાના ડેડી તરીકેની ફરજ બજાવતા કરણ જોહર સહિતની અનેક બોલિવૂડ સેલિબ્રિટીએ આ કપલ પર અભિનંદનોનો વરસાદ કર્યો હતો. ગત એપ્રિલની ૧૪મી તારીખે આલિયા



અને રણબીરનાં લગ્ન થયાં હતાં. તે પછી તેમણે બહુ ઝડપથી તેમણે પોતે માં-બાપ બની રહ્યાની જાહેરાત કરતાં લોકોએ સાનંદાશ્ચર્ય

અનુભવ્યું હતું. આ સાથે જ કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. નીતુ કપૂર એક સેટ પર હતી ત્યારે તસવીરકારોએ નીતુને દાદી, દાદી કહીને સંબોધી હતી. પછી તેણે કહ્યું હતું કે, હવે તે પોતાના પુત્રની આગામી ફિલ્મ શમશેરાની રાહ જોઈ રહી છે. આલિયાને પોતાની દીકરી માનતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર રણબીર-આલિયાના લગ્નની એક તસવીર શેર કરીને ઉનકે લિયે બહુત પ્યાર, મેરા બચ્ચા મા બનને જા રહા હૈ, મેં અપની ભાવના વ્યક્ત નહીં કર સકતા...બહુ ઉત્સાહિત હું, લવ યૂ દોનો.



એન્ડી મરે બીજા રાઉન્ડમાં પરાજિત

બે વાર વિમ્બલ્ડન ચેમ્પિયન રહી ચૂકેલો એન્ડી મરે બીજા રાઉન્ડમાં જોન ઇસનરની સામે હારી ગયો

લંડન

બે વાર વિમ્બલ્ડન ચેમ્પિયન રહી ચૂકેલો એન્ડી મરે અહીં ઓલ ઈંગ્લેન્ડ ક્લબ પર મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં જોન ઇસનરની સામે ચાર સેટના મુકાબલામાં પરાજિત થયો હતો. મરેને ૨૦માં

ક્રમાંકિત અમેરિકન ખેલાડીએ ૬-૪, ૭-૬ (૪), ૬-૭ (૩), ૬-૪થી હરાવ્યો હતો. નોંધનીય છે કે મરે પાછલા ૭૭ વર્ષમાં પ્રથમવાર ૨૦૧૩માં વિમ્બલ્ડન ખિતાબ જીતનારો બ્રિટિશ ખેલાડી બન્યો હતો. તેણે તે પછી ૨૦૧૬માં પણ ફરીવાર વિમ્બલ્ડન મેન્સ

સિંગલનો ખિતાબ જીતી લીધો હતો. પાછલા ૧૩ તક દરમિયાન મરે હંમેશાં વિમ્બલ્ડનમાં ઓછામાં ઓછું ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવવામાં સક્ષમ રહ્યો હતો. તેણે ૨૦૦૫માં પદાર્પણ કર્યું હતું અને ૨૦૨૧માં થઈ રાઉન્ડમાં હાર્યો હતો.

વિમ્બલ્ડન : સાનિયા મિર્ઝા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર થઈ



લંડન

ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા વિમ્બલ્ડન મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર ફેંકાઈ ગઈ છે. સાનિયા મિર્ઝા અને ચેક રિપબ્લિકન જોડીદાર લૂચી હદેકની જોડીને પોલેન્ડની માગ્દાલેના ફ્રેચ અને બ્રાઝિલની બીટરીઝ માર્થયાની જોડીએ ૪-૬, ૬-૪, ૬-૨થી પરાજિત કરી હતી. નોંધનીય છે કે સાનિયાનો આ આખરી વિમ્બલ્ડન મહિલા ડબલ્સનો મુકાબલો છે કેમ કે સાનિયા પહેલેથી જ સન્યાસની જાહેરાત કરી ચૂકી છે અને આ સિઝનને તેની આખરી સિઝન જાહેર કરી ચૂકી છે. આ સિઝનમાં સાનિયા અત્યાર સુધીમાં કોઈ ખિતાબ જીતી શકી નથી. સાનિયા-લૂચીની જોડી ફ્રેન્ચ ઓપનમાં પણ ત્રીજા રાઉન્ડમાં બહાર થઈ હતી.

સેરેનાનું હાર્ટબ્રેક

વિમ્બલ્ડન : સેરેનાનો ૧૧૫મો ક્રમાંક ધરાવતી હાર્મોની ટેન સામે પરાજય



લંડન : અમેરિકાની ભૂતપૂર્વ નંબર-૧ ટિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે ૩૬૪ દિવસ બાદ વિમેન્સ સિંગલ્સમાં પુનરાગમન કર્યું હતું પરંતુ વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ૨૩ ગ્રાન્ડસ્લેમની ચેમ્પિયન હારી ગઈ હતી. સેરેનાની રમતમાં ઘણા ચઢાવઉતાર જોવા મળ્યા હતા. સેરેનાએ પોતાનો છેલ્લો સિંગલ્સનો મુકાબલો પણ વિમ્બલ્ડનમાં ગયા વર્ષની ૨૦મી જૂને રમી હતી પરંતુ તે સમયે પ્રથમ સેટમાં જ ઈજાગ્રસ્ત થવાના કારણે તેને ટૂર્નામેન્ટમાંથી બસી જવાની ફરજ પડી હતી. સંપૂર્ણ ફિટ થયા બાદ કોર્ટ ઉપર પરત ફરેલી સેરેનાનો વિશ્વની ૧૧૫મી ક્રમાંકિત ફ્રાન્સની હાર્મોની ટેન સામેના પ્રથમ રાઉન્ડમાં ૭-૫, ૧-૬, ૭-૬ (૧૦-૭)ના સ્કોરથી પરાજય થયો હતો. આ મુકાબલો લગભગ ત્રણ કલાક ચાલ્યો હતો. સેરેના સેન્ટર કોર્ટ ઉપર રમવા માટે ઊતરી ત્યારે પ્રેક્ષકોએ ઊભા થઈને તેનું અભિવાદન કર્યું હતું. ૪૦ વર્ષીય સેરેનાએ છ વર્ષ પહેલાં પોતાના સાત વિમ્બલ્ડન ટાઈટલમાંનું છેલ્લું જીત્યું હતું.

ગર્ભવતી એલિના વિમ્બલ્ડનમાં જીતેલી રકમ યુદ્ધ પીડિતો માટે દાનમાં આપી દેશે



લંડન

વિમ્બલ્ડનમાં ૨મી રહેલી યૂક્રેનની મહિલા ટેનિસ ખેલાડીને પુરસ્કાર તરીકે જે ધનરાશિ મળશે તે દેશને અને પીડિત પરિવારોને દાન કરી દેશે. રેન્કિંગમાં ૪૦મો ક્રમ ધરાવતી એલિના ગર્ભવતી હોવા છતાં પણ દેશની મદદ માટે ધન એકત્ર કરી રહી છે. એલિના ફ્રાન્સના ટેનિસ સ્ટાર ગાએલ મોફિલ્સના બાળકની માતા બનવાની છે. ગર્ભવતી હોવાના કારણે ભલે તે ટેનિસ ટૂર્નામેન્ટમાં રમી રહી નથી પણ રશિયા સામે યુદ્ધ લડી રહેલાં યૂક્રેનની મદદ માટે તે ધન એકત્ર કરવાના કામે લાગી ગઈ છે. યૂક્રેનના પ્રેસિડેન્ટે એલિનાને દેશની પ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. બીજી તરફ ૨૮મી વરિયતા પ્રાપ્ત અન્હેલિના કલિનિના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

આ માતું હિન્દુસ્તાન છે, અહીં હિન્દુનાં જીવનું પણ મહત્વ છે : બબીતા ફોગટ



ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ની ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સપોર્ટમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ ઉદેપુરમાં કનૈયાલાલ દરજીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ ઘટનાના ઉદેપુર અને રાજસ્થાન સહિત સમગ્ર ભારતમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. દેશ-વિદેશમાંથી બિન-મુસ્લિમ અને મુસ્લિમ અગ્રણીઓ આ તાલિબાની ઘટનાની નિંદા કરી રહ્યા છે. આ નિર્મમ હત્યાને લઈને દેશભરમાં લોકોમાં ગુસ્સો છે. આ બધાની વચ્ચે મહિલા પહેલવાન અને ભારતીય જનતા પાર્ટીના ભાગરૂપ બબીતા ફોગટે પણ સોશિયલ મીડિયા મારફત આ ઘટનાની નિંદા કરી છે. વાસ્તવમાં તેણે જે ટ્વિટ કરી છે તે હાલમાં ભારે વાઈરલ થઈ રહી છે. બબીતાએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બબીતાના હાથમાં એક કાગળ છે જેના પર લખ્યું છે કે, આ માતું હિન્દુસ્તાન છે. અહીં હિન્દુઓનો જીવ મહત્વ ધરાવે છે. #HinduLivesMatter.

રોમાંચક મેચમાં ભારતે આયરલેન્ડને ચાર રને હરાવ્યું

ડબલિન

યુવા બેટ્સમેન દીપક હુડાની આક્રમક સદી, સંજૂ સેમસનના ઉપયોગી ૭૭ રન બાદ પેસ બોલર ભુવનેશ્વર અને ઉમરાન મલિકે છેલ્લી ઓવરમાં કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ભારતે અહીં રમાયેલી બીજી ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ભારે રસાકસી બાદ આયરલેન્ડને ચાર રનથી પરાજય આપીને બે મેચની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૨૫ રન બનાવ્યા હતા. તેના જવાબમાં આયરલેન્ડની ટીમે પાંચ વિકેટે ૨૨૧ રન બનાવ્યા હતા. દીપક હુડાને મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. રનચેઝ કરનાર આયરલેન્ડની ટીમને અંતિમ ઓવરમાં ૧૭ રનની જરૂર હતી પરંતુ માત્ર ૧૩ રન બનાવી શકી હતી. ૨૨૬ રનના ટાર્ગેટ સામે મેદાને પડેલી આયરલેન્ડની ટીમ માટે



ઓપનર પોલ સ્ટર્લિંગ અને એન્ડ્ર્યુ બાલબર્નીએ ૫.૪ ઓવરમાં ૭૨ રનની ભાગીદારી નોંધાવીને આક્રમક શરૂઆત કરી હતી. સ્ટર્લિંગ ૧૮ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૪૦ રન બનાવીને આઉટ થયો હતો. બાલબર્નીએ ૩૭ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને સાત સિક્સર વડે ૬૦ રન બનાવ્યા હતા.

ગુજરાતના ૧૨ બાળકોની કોમનવેલ્થ ગેમના ટ્રાયલ માટે પસંદગી કરાઈ

સાબરકાંઠા

ગુજરાતના ૧૨ જેટલા બાળકોની કોમનવેલ્થ ગેમના ટ્રાયલ માટે પસંદગી થઈ છે. જેના ભાગરૂપે તમામને ઓરિસ્સાના કટક ખાતે બોલાવવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડના લંડનમાં આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. જેમાં તલવારબાજીમાં ગુજરાતના ૧૨ જેટલા બાળકોની પસંદગી કરાઈ છે. તેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી ભક્તિ પટેલનો પણ સમાવેશ થાય છે. ભક્તિ પટેલે અત્યાર સુધી ફૂટબોલ વોલીબોલ તેમજ કરાટે જેવી ગેમમાં ગોલ્ડ મેડલ

મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે સમગ્ર દેશ માટે કોમનવેલ્થ ગેમ સહિત ઓલમ્પિકમાં નામના અપાવવાની ખેવના સાથે છ માસ પૂર્વે તલવારબાજીમાં ભક્તિ પટેલે હાથ અજમાવ્યો હતો. જોકે પહેલાથી જ કુશાગ્ર બુદ્ધિની સાથે સાથ રમત પ્રત્યે વિશેષ રસ અને રુચિ દાખવનારી ભક્તિ પટેલે તલવારબાજીમાં પણ પોતાનો કસબ દેખાડ્યો છે. ખેલ મહાકુંભ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલી ભક્તિ પટેલને તલવારબાજીમાં ગુજરાત ખેલકૂદ વિભાગ દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં પસંદગી કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડના વન-ડે વર્લ્ડ કપ સુકાની ઇયોન મોર્ગને ક્રિકેટને અલવિદા કરી

લંડન

છેલ્લા કેટલાક સમયથી સતત કંગાળ ફોર્મનો સામનો કરી રહેલા ઈંગ્લેન્ડના વન-ડે વર્લ્ડ કપ સુકાની ઇયોન મોર્ગને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી હતી. પોતાની ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં મોર્ગને ત્રણેય ફોર્મેટમાં કુલ ૧૦ હજાર કરતાં વધારે રન બનાવ્યા હતા. આયરલેન્ડના ડબલિનમાં જન્મેલા મોર્ગને ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયા ખાતેના વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવાની ઈચ્છા રાખી હતી પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે તેણે પોતાનો નિર્ણય



મોર્ગનેને નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમ વન-ડે તથા ટી૨૦ ફોર્મેટમાં નંબર-૧ બની હતી. તેણે ૨૦૧૫માં એલિસ્ટર કૂક પાસેથી કેપ્ટનશિપનો તાજ મેળવ્યો હતો.

બદલ્યો હતો. મોર્ગને ૨૪૮ વન-ડેમાં ૭૭૦૧ રન, ૧૧૫ ટી૨૦ મેચમાં ૨૪૫૮ રન બનાવ્યા હતા. તેણે ટી૨૦માં ઈંગ્લેન્ડ માટે ૨૦૦૯માં નેધરલેન્ડ્સ સામે પદાર્પણ કર્યું હતું. મોર્ગને કારકિર્દીમાં ૧૬ ટેસ્ટ રમી હતી જેમાં તે માત્ર ૭૦૦ રન બનાવી શક્યો હતો. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ ૨૦૧૨માં પાકિસ્તાન સામે રમી હતી.

SHIV FINANCIAL SERVICES

Serving Community Since 2009
Canada

BEST RATES AVAILABLE

FREE PERSONAL TAX-FILE FOR NEW IMMIGRANTS

SUPER VISA MEDICAL INSURANCE & VISITOR TO CANADA MEDICAL INSURANCE

JAGDISHBHAI SEVAK
Insurance Broker

647-236-7620

sevak_2007@hotmail.com • www.shivfinancialservices.ca

"PROPER INSURANCE COVERAGE IS PEACE OF MIND"

યુએસના સેન એન્ટોનિયોમાં ટ્રકમાં 50થી વધુ વસાહતીનાં મૃતદેહ મળતાં ચક્રચાર

16 હોસ્પિટલમાં દાખલ, ત્રણની ધરપકડ કરાઈ, પોલીસે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી સેન એન્ટોનિયો

અમેરિકાના ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયોમાં અંતરિયાળ રસ્તા પર ત્યજી દેવાયેલા ટ્રેક્ટર-ટ્રેલરમાં ૪૬ વસાહતીઓનાં મૃતદેહ મળી આવતાં હોબાળો મચી ગયો છે. આ વસાહતીઓની મેક્સિકોથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં હોવાની અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે. અધિકારીઓએ કહ્યું કે ટ્રકમાં હયાત અન્ય ૧૬ લોકોની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ફાયર ચીફ ચાર્લ્સ હૂડે કહ્યું કે તીવ્ર ગરમીના કારણે ટ્રકમાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ટ્રકમાં પ્રવાસ કરતા ૧૨ વયસ્કો અને ચાર બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બધા જ લોકોના શરીર ગરમીથી તપી ગયા હતા અને ડીહાઈડ્રેટ હતા. ટ્રકમાં જરા પણ પાણી નહોતું.



પોલીસે કહ્યું કે, આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. મેક્સિકોથી અમેરિકામાં માનવ તસ્કરીના પ્રયાસમાં વસાહતીઓના મોતની તાજેતરના સમયમાં આ મોટી દુર્ઘટના છે. સેન એન્ટોનિયોમાં આ દુર્ઘટના થઈ ત્યાં તાપમાન ૩૯.૪ ડિગ્રી સે. હતું.

ભારતીય મળના સતનામસિંહની ન્યૂયોર્કમાં ગોળી મારી હત્યા કરાઈ

ન્યૂયોર્ક

ન્યૂયોર્ક શહેરમાં ૩૧ વર્ષના એક ભારતીય મળના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શહેરના કિવન્સ વિસ્તારમાં સતનામસિંહ નામનો આ વ્યક્તિ મિત્ર પાસેથી ઉધાર લીધેલી એસયુવીમાં પાર્કિંગમાં બેઠો હતો ત્યારે જ હત્યારાએ માથામાં ગોળી મારી હતી. આ ઘટના અમેરિકાના અન્ય રાજ્ય મેરીલેન્ડમાં સાઈચરણ નામના એક ભારતીય વ્યક્તિના માથામાં ગોળી મારીને કરવામાં આવેલી હત્યાની ઘટનાના થોડા દિવસ બાદ જ બની છે. અહેવાલો અનુસાર સતનામ કાળા કલરની જીપની પાછલી બેઠકમાં બેઠો હતો ત્યારે જ તેને ગોળી મારવામાં આવી



હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ પાર્કિંગ તેના ઘરની નજીકમાં જ છે. સતનામને ગળામાં અને છાતી પર ગોળી મારવામાં આવી હતી તેને તત્કાળ નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ ત્યાં તેનું મોત થયું હતું. અહેવાલો અનુસાર સતનામ પોતાના મિત્ર પાસેથી આ વાહન ઉધાર લીધું હતું અને કોઈને લેવા માટે આવ્યો હતો.

ભેટમાં મળેલી ઘડિયાળો વેચી પૂર્વ પીએમ ઇમરાને ૩.૬ કરોડ કમાયા

પ્રસિધ્ધ અહેવાલમાં તપાસ રીપોર્ટનો ઉલ્લેખ

ઈસ્લામાબાદ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન નવા નવા આરોપોમાં ઘેરાતા જાય છે. તે બીજા દેશોના પ્રમુખો પાસેથી મળેલી ભેટોને વેચવાના આરોપોનો સામનો કરી રહ્યાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે.

આજે પ્રકાશિત થયેલા એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ગિફ્ટમાં મળેલી ત્રણ ઘડિયાળ એક સ્થાનિક ડીલરને વેચીને લાખો રૂપિયા કમાવ્યા હતાં.

રિપોર્ટમાં સત્તાવાર તપાસના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે પદ પર રહીને ઇમરાન ખાને ભેટમાં મળેલી ત્રણ ઘડિયાળ સ્થાનિક ડીલરને વેચીને ગેરકાયદેસર રીતે ૩.૬ કરોડ રૂપિયા કમાવ્યા હતાં. આ ઘડિયાળ અગાઉ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દર્શાવવામાં આવેલા ભેટોમાં સામેલ ન હતી. એક સત્તાવાર તપાસ મુજબ સૌથી મોઢી ઘડિયાળ (૧૦.૧ કરોડ રૂપિયાથી વધુની કીંમત) તત્કાલીન વડાપ્રધાન દ્વારા પોતાના મૂલ્યના ૨૦ ટકા પર રાખી લેવામાં આવી હતી.

લુઈસિયાના અને ઉતાહની કોર્ટોએ ગર્ભપાત પરના પ્રતિબંધ ઉપર અસ્થાયી રોક લગાવી

અમેરિકામાં ગર્ભપાતની લડાઈ સુપ્રીમ કોર્ટમાંથી રાજ્યોની વિવિધ કોર્ટમાં પહોંચી

ન્યૂ ઓર્લીન્સ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગર્ભપાતનો કાયદાકીય અધિકાર આપતો ૫૦ વર્ષ જૂનો યુકાદો બદલી નાખીને મહિલાઓ પાસેથી ગર્ભપાતનો કાયદાકીય અધિકાર પરત લઈ લીધો છે. અમેરિકામાં ગર્ભપાત અંગેની આ લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાંથી વિવિધ રાજ્યોની કોર્ટોમાં પહોંચી ગઈ છે. લુઈસિયાના અને ઉતાહની કોર્ટોએ ગર્ભપાત પરના પ્રતિબંધ પર અસ્થાયી ધોરણે રોક લગાવી દીધી છે. જ્યારે સાઉથ કેરોલાઈનાની એક ફેડરલ કોર્ટે જણાવ્યું છે કે ગર્ભધારણના છ સપ્તાહ પછી ગર્ભપાત કરાવી ન શકાય.

સુપ્રીમ કોર્ટ દ્વારા ગર્ભપાતને મળેલા બંધારણીય સંરક્ષણને શુક્રવારે સમાપ્ત કરવામાં આવ્યા પછી રાજ્યોની કોર્ટોમાં




અરજીઓ દાખલ કરવામાં આવી છે. એક પક્ષ ઈચ્છે છે કે પ્રતિબંધનો અમલ તાત્કાલિક શરૂ થાય. જ્યારે બીજા બાજુ બીજો પક્ષ ઈચ્છે છે કે આ પ્રતિબંધને રોકવા અથવા આ પ્રતિબંધને લાગુ કરવા વધુ સમયની માગ કરી રહ્યો છે.

મિસૌરી ખાતે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અનેક લોકોના મૃત્યુ, 50થી વધુ ઘાયલ

વોશિંગ્ટન

અમેરિકાના મિસૌરી ખાતે ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. અહેવાલ અનુસાર, અમેરિકાના મિસૌરી ખાતે સોમવારે એક ડમ્પ ટ્રક સાથે અથડાયા બાદ એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અનેક લોકોના મોત થયા હતા. ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા હતા. હાલમાં રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

એમટ્રેક સેન્ટર તરફથી મળતી જાણકારી પ્રમાણે, 27 જૂનના રોજ



બપોરે 12:42 વાગ્યે લોસ એન્જલસથી શિકાગો સુધીના BNSF ટ્રેક પર પૂર્વમાં મુસાફરી કરી રહેલી સાઉથવેસ્ટ ચીફ ટ્રેન એક ટ્રક સાથે અથડાઈ હતી.

જેના કારણે ટ્રેનના 8 બોગી અને 2 એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનમાં લગભગ 243 મુસાફરો અને 12 કૂ મેમ્બર સવાર હતા.

નાઈજીરિયામાં મન્કીપોક્સથી 1નું મોત થયું : વિશ્વમાં 3413 સંક્રમિત

અબુજા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નાઈજીરિયામાં મન્કીપોક્સના કારણે વિશ્વનું પ્રથમ મોત નોંધ્યું હોવાની પુષ્ટિ કરી છે. જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે વિશ્વના 50 દેશોમાં અત્યાર સુધીમાં મન્કીપોક્સના કુલ 3413 કેસ સામે આવ્યા છે જેમાં નાઈજીરિયામાં 41 સંક્રમિતો છે. જો કે ભારત માટે મોટી રાહતની બાબત એ છે કે આપણા દેશમાં મન્કીપોક્સનો એકપણ પેશન્ટ નથી. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત લગભગ સાત રાજ્યોમાંથી જીનોમ

સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલ્સમાંથી કોઈ પોઝિટિવ રિપોર્ટ નથી. ડબ્લ્યુએચઓ અનુસાર 17થી 22 જૂન વચ્ચે આઠ નવા દેશોમાં 1310 કેસ સામે આવ્યા છે.

નોંધનીય છે કે ભારત સરકારે દરેક શંકાસ્પદ સેમ્પલ્સનું જીનોમ સિક્વન્સિંગ કરાવવાનો આદેશ દીધો હતો. એક મેથી 23 જૂન વચ્ચે 16 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી હતી. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર મન્કીપોક્સના સૌથી વધારે કેસ બ્રિટનમાં નોંધાયા હતા. આંકડા પ્રમાણે જોઈએ તો બ્રિટનમાં 793 કેસ છે.

રશિયાએ US રાષ્ટ્રપતિના પત્ની અને પુત્રી સહિત 25 લોકો સામે લગાવ્યો પ્રતિબંધ

મોસ્કો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્ની અને પુત્રી પર રશિયાએ અન્ય 23 અમેરિકનો સાથે પ્રતિબંધ મૂક્યો છે. આ જાણકારી રશિયન વિદેશ મંત્રાલયે આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, રશિયા રાજકીય અને જાહેર વ્યક્તિઓ સામે સતત વધતા અમેરિકી પ્રતિબંધોની પ્રતિક્રિયાના રૂપમાં 25 અમેરિકી નાગરિકોને 'સ્ટોપ લિસ્ટ'માં જોડવામાં આવ્યા છે. રશિયન વિદેશ મંત્રાલયના આ લિસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્ની અને પુત્રી સહિત અનેક અમેરિકી સીનેટર પણ સામેલ છે જેમાં મેનના સુસાન કોલિન્સ, કેટકીના મિચ મેકકોનેલ, આયોવાના ચાર્લ્સ ગ્રાસલી, ન્યુ યોર્કના કર્સ્ટન ગિલિબ્રેડ સામેલ છે.

યુકેન સામેના યુદ્ધથી રશિયાને કમરતોડ નાણાકીય ફટકો રશિયા 103 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર વિદેશી દેવું ચૂકવણીમાં ડિફોલ્ટ

મોસ્કો

યુકેન સામે છેડેલા યુદ્ધને કારણે રશિયાને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. રશિયાની અર્થવ્યવસ્થા પર પણ માર પડી રહ્યો છે. એક અહેવાલ અનુસાર રશિયાએ તેના ૧૦૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વિદેશી દેવા પર ડિફોલ્ટ કર્યું છે.

યુકેન સાથે ચાલી રહેલા યુદ્ધ બાદ અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોએ રશિયા સાથેના વેપાર પર પ્રતિબંધ

લગાવી દીધો છે. વૈશ્વિક બજારમાં રશિયા સાથે ડોલરના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યા પછી રશિયાએ તેના સ્થાનિક ચલણ રૂબલમાં ચૂકવણી કરવાની ઓફર કરી જેને અમેરિકાના નેજા હેઠળના અન્ય દેશોએ નકારી કાઢી હતી.

૨૭ મેના રોજ રશિયાએ વિદેશી દેવું પર ૧૦ કરોડ ડોલરનું વ્યાજ ચૂકવવાનું હતું. આ દેવાની ચૂકવણીની તારીખ પર વધારાનો એક મહિનાનો ગ્રેસ પીરિયડ અપાયો હતો.

એટલાન્ટામાં સેન્ડવીચમાં વધુ મેયોનીઝ નાખતાં ઉશ્કેરાયેલા ગ્રાહકે મહિલાને ગોળી મારી

વોશિંગ્ટન

એટલાન્ટાના સેન્ડવિચ આઉટલેટ પર પહોંચેલા ગ્રાહકે ઓડર આપ્યા બાદ કર્મચારીએ સેન્ડવિચ બનાવીને આપી હતી. જો કે તેમાં મેયોનીઝ વધુ નાંખી દીધું હોવાથી આ ગ્રાહકે આઉટલેટની અંદર ફાયરિંગ કર્યું હતું અને તેમાં એક મહિલા કર્મચારીનું મોત થયું હતું. અન્ય એક કર્મચારી ઘાયલ થઈ છે. આઉટલેટના માલિક વિલી ગ્લેને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, વધારે પડતા મેયોનીઝ લગાવવાના કારણે ઝઘડો શરૂ થયો હતો તે વાત સાચી છે સેન્ડવિચમાં મેયોનીઝ વધારે નંખાયું છે. ડ્યુટી પર હાજર મેનેજર પાસે પણ ગન હતી પણ તેણે ગ્રાહક પર ગોળી ચલાવી નહોતી.

